

[10-C]

No. of printed page: 1

SARDAR PATEL UNIVERSITY
M A (II Semester) Examination
29 April 2015 (Wednesday)
10.30 am - 12.00 pm
PA02SGUJ02 – Life Enrichment Course

Total Marks : 35

ગુજરાતી:

- પ્ર. ૧ તમારા પોતાના જીવનનું ધ્યેય શું છે? તે પ્રાપ્ત કરવા માટે તમે કેવા પ્રયત્નો કરી રહ્યાં છો, (૧૭)
 એ અંગે વિગતે ચર્ચા કરો.

અથવા

- પ્ર. ૧ નીચેના બંને વિષય અંગે ટૂંકનોંધ લખો: (૧૭)
 (૧) સર્વાંગી જીવન (૨) વાણીવિવેક

- પ્ર. ૨ નીચેનામાંથી ગમે તે બે વિષય અંગે ટૂંકનોંધ લખો: (૧૮)
 (૧) શ્રદ્ધા, એકાગ્રતા
 (૨) શરીરની તપસ્યા
 (૩) વ્યક્તિત્વ વિકાસ
 (૪) શરીર, મન અને અંતરાત્માની તપસ્યા

English Translation:

- Q. 1 What is the aim of your life? Discuss in detail your efforts to achieve this goal. (17)
OR
 Q. 1 Write short note on: (17)
 (1) Integral life (2) Austerity of Speech
 Q. 2 Write short note: (Any Two) (18)
 (1) Faith, Concentration
 (2) Austerity of Body
 (3) Personality Development
 (4) Austerities of Body, Mind and Soul (Psychic)

हिन्दी अनुवाद:

- પ્ર. ૧ આપ અપને જીવન કે ધ્યેય કે બારે મેં લિખિએ । યહ ધ્યેય પ્રાપ્ત કરને કે લિએ આપ (૧૭)
 કેસા પ્રયત્ન કર રહે હૈં ઇસકી ચર્ચા કિજિએ ।

અથવા

- પ્ર. ૧ ટિપ્પણી લિખિએ: (૧૭)
 (૧) સર્વાંગી જીવન (૨) વાણી વિવેક

- પ્ર. ૨ કિન્હીં દો પર ટિપ્પણી લિખિએ: (૧૮)
 (૧) શ્રદ્ધા, એકાગ્રતા
 (૨) શરીર કી તપસ્યા
 (૩) વ્યક્તિત્વ વિકાસ
 (૪) શરીર, મન ઓર અંતરાત્મા કી તપસ્યા

